DN:
email=mail@realpatidar.com
Date: 2016.05.24 17:57:17
+05'30'

realpatidar.com

# Series 62 -Controversy of Associating Imam Shah with Atharv Veda /અથર્વવેદ સાથે ઈમામશાહનું નામ જોડવાથી વકરેલો વિવાદ

તા.૨૪-૦૫-૨૦૧૬

**પ્રસંગ:** શ્રીમદ્ ભાગવત દશાવતારનું આયોજન તા. ૧૮-૦૫-૨૦૧૬ થી ૨૪-૦૫-૨૦૧૬
**સ્થળ:** ગામ દુર્ગાપુર, તા. માંડવી, જી. કચ્છ, ગુજરાત
**વક્તા:** શ્રી જનાર્ધન મહારાજ - ગામ ફેજપુર (મહારાષ્ટ્ર)

**મુખ્ય ભાગ:**
પીરાણા સતપંથના અનુયાયીયો દ્વારા હાલમાં શ્રીમદ ભાગવત દસતાવાર કથાનું આયોજન થઇ રહ્યું છે. જેની આમંત્રણ પત્રિકા ગામો ગામ બાંટવામાં આવેલ છે. આ પત્રિકાના એક પાનાં ઉપર ઈમામશાહનું નામ અથર્વવેદ સાથે જોડેલ છે. (સંપૂર્ણ આમંત્રણ પત્રિકા આ લેખ સાથે જોડેલ છે.)

**આમંત્રણ પત્રિકાનું પાનું:**

realpatidar.com

# Real Patidar Library

This book/literature/article/material may be used for research, teaching, and private study purposes. Any substantial or systematic reproduction, redistribution, reselling, loan, sub-licensing, systematic supply, or distribution in any form to anyone is expressly forbidden.

The library does not give any warranty express or implied or make any representation that the contents will be complete or accurate or up to date. The library shall not be liable for any loss, actions, claims, proceedings, demand, or costs or damages whatsoever or howsoever caused arising directly or indirectly in connection with or arising out of the use of this material.

Full terms and conditions of use: http://www.realpatidar.com

## About Real Patidar books

Real Patidar's mission is to organize the information on Satpanth religion, which is a  Nizari Ismaili sect of Shia branch of Islam, and to make it universally accessible and useful. Real Patidar Books helps readers discover the material on Satpanth online while helping authors and researchers in their studies. You can know more by visiting http://www.realpatidar.com

# Series 62 -Controversy of Associating Imam Shah with Atharv Veda /અથર્વવેદ સાથે ઈમામશાહનું નામ જોડવાથી વકરેલો વિવાદ

તા.૨૪-૦૫-૨૦૧૬

**પ્રસંગ:** શ્રીમદ્ ભાગવત દશાવતારનું આયોજન તા. ૧૮-૦૫-૨૦૧૬ થી ૨૪-૦૫-૨૦૧૬
**સ્થળ:** ગામ દુર્ગાપુર, તા. માંડવી, જી. કચ્છ, ગુજરાત
**વક્તા:** શ્રી જનાર્ધન મહારાજ - ગામ ફેજપુર (મહારાષ્ટ્ર)

**મુખ્ય ભાગ:**
પીરાણા સતપંથના અનુયાયીયો દ્વારા હાલમાં શ્રીમદ ભાગવત દસતાવાર કથાનું આયોજન થઇ રહ્યું છે. જેની આમંત્રણ પત્રિકા ગામો ગામ બાંટવામાં આવેલ છે. આ પત્રિકાના એક પાનાં ઉપર ઈમામશાહનું નામ અથર્વવેદ સાથે જોડેલ છે. (સંપૂર્ણ આમંત્રણ પત્રિકા આ લેખ સાથે જોડેલ છે.)

**આમંત્રણ પત્રિકાનું પાનું:**

realpatidar.com




આમ તો અન્ય ત્રણ વેદો સાથે કોઈ ન કોઈ ઋષિઓના નામો જોડેલ છે, પણ અથર્વવેદ સાથે એક મુસ્લિમ વ્યક્તિનું નામ એટલે કે ઈમામ શાહ જોડવાથી હિંદુ સમાજમાં મોટો ખળભળાટ મચેલો છે.

realpatidar.com

realpatidar.com

**<u>૧. તો ચાલો આપણે જોઈએ કે અ ખળભળાટ પાછળ શું કારણો હોઈ શકે?</u>**

આ પ્રશ્નનો સાચો જવાબ મેળવવો હોય તો આપણે સતપંથની સ્થાપના, ઈમામ શાહનો ઈતિહાસ અને સતપંથના ધાર્મિક શાસ્ત્રો જાણવો પડશે. તેમજ વેદો ક્યાંથી આવ્યા તે પણ જાણવું પડશે.

આ વિષય આગળ વધારવાથી પહેલાં આપણે પીરાણા સતપંથ દ્વારા બહાર પડેલ એક પેમ્પલેટ બારામાં થોડું જાણી લેવું જોઈએ. એ પેમ્પલેટ નીચે આપેલ છે.

ચાર યુગના પૂજ્ય પાત્રોની યાદી

यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत । अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् ॥
परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम् । धर्मसंस्थापनार्थाय सम्भवामि युगे युगे ॥
"ॐ नमो श्री निष्कलंकी नारायण जनार्दनाय भस्मायुधाय विघ्महे दिव्यनेत्राय धीमहि, तन्नोज्वरहर: प्रचोदयात"

| અ.નં. | વિગત | પહેલો સતયુગ | બીજો ત્રેતાયુગ | ત્રીજો દ્વાપરયુગ | ચોથો કલિયુગ |
|---|---|---|---|---|---|
| ૧ | વેદ | ઋગ્વેદ | યજુર્વેદ | સામવેદ | અથર્વવેદ |
| ૨ | યુગાન્તરસદગુરૂ | શ્રી અમરતેજ ઋષિ | શ્રી વશિષ્ઠ ઋષિ | શ્રી વેદવ્યાસ ઋષિ | શ્રી ઈમામશાહ મહારાજ |
| ૩ | ભક્તનું નામ | શ્રી પ્રહલાદ | શ્રી હરિશ્ચંદ્રરાજા | શ્રી યુધિષ્ઠિર | શ્રી કમળાકુંવર |
| ૪ | દાનવનું નામ | શ્રી હિરણ્યકશ્યિપુ | રાવણ | દુર્યોધન | દહીંત કાલીંગો |
| ૫ | યજ્ઞનું નામ | હસ્તિદાન યજ્ઞ | અશ્વદાન યજ્ઞ | ગૌદાન યજ્ઞ | વારી યજ્ઞ |
| ૬ | આસન ઘટ-પાટ | સોનાના | રૂપાના | ત્રાંબાના | માટીના |
| ૭ | જાપ | ૐ શ્રી નરસિંહ | ૐ શ્રી રામ | ૐ શ્રી કૃષ્ણ | ૐ શ્રી નિષ્કલંકી નારાયણ |
| ૮ | વ્રત | સુદ ૧૧ને રવિવાર | સુદ ૧૪ ને મંગળવાર | સોમવતી અમાસ | સુદ ૨ને શુક્રવાર |
| ૯ | યુગનો પૂજ્ય રંગ | રક્ત વર્ણ | જરદ વર્ણ | શ્યામ વર્ણ | શ્વેતવર્ણ |
| ૧૦ | દિશા | ઉત્તર | પૂર્વ | દક્ષિણ | પશ્ચિમ |
| ૧૧ | તીર્થ | ૨૪ તીર્થ | ૧૮ તીર્થ | ૧૪ તીર્થ | ૧૨ તીર્થ |
| ૧૨ | અવતાર | (ચાર) શ્રી મચ્છ, શ્રી કૂર્મ, શ્રી વરાહ, શ્રી નરસિંહ | (ત્રણ) શ્રી વામન, શ્રી પરશુરામ, શ્રી રામ | (બે) શ્રી કૃષ્ણ, શ્રી બુધ | (એક) શ્રી નિષ્કલંકી (કલ્કી) નારાયણ |
| ૧૩ | સ્થળ પૂજા | કાશ્મીર | અયોધ્યા | ગોકુળ | કુંવારીકા ક્ષેત્ર-પીરાણા |
| ૧૪ | ક્ષેત્ર | ચરણાપુરી | લંકાપુરી | મથુરા | પંચનદી-વીંઠા |
| ૧૫ | આયુધ | નખ | ધનુષ્ય | ચક્ર | તલવાર (ખાંડું) |
| ૧૬ | સતીઓના નામ | શ્રી બાઈ | શ્રી તારામતી | શ્રી દ્રોપદી | શ્રી સુરજારાણી |
| ૧૭ | નદીઓના નામ | ગંગાજી | સરયુ | યમુનાજી | સાબરમતી |
| ૧૮ | મોક્ષપદ પામ્યા | પાંચ કરોડ | સાત કરોડ | નવ કરોડ | બાર કરોડ |
| ૧૯ | મનુષ્ય અવતાર | ૩૫ અવતાર | ૨૫ અવતાર | ૧૬ અવતાર | ૮ અવતાર |
| ૨૦ | મનુષ્ય આયુષ્ય | ૧,૨૦,૦૦૦ વર્ષ | ૧૨૦૦૦ વર્ષ | ૧૨૦૦ વર્ષ | ૧૨૦ વર્ષ |
| ૨૧ | દાગ | વાયુદાગ | જળદાગ | અગ્નિદાગ | ભુમિદાગ |
| ૨૨ | યુગનું આયુષ્ય | ૧૭,૨૮૦૦૦ વર્ષ | ૧૨,૯૬૦૦૦ વર્ષ | ૮,૬૪૦૦૦ વર્ષ | ૪,૩૨૦૦૦ |

સતપંથ પ્રકાશન સમિતિ
પ્રેરણાપીઠ-પીરાણા, તા.દસક્રોઈ, અમદાવાદ-૩૮૨૪૨૫

**<u>ચોખવટ:</u>** ઉપર જણાવેલ પીરાણા સતપંથનું આ પેમ્પલેટ હિંદુ ધર્મ પ્રમાણે નથી.

realpatidar.com

realpatidar.com

ઉપર જણાવેલ પેમ્પલેટ એ સતપંથના સિદ્ધાંતોને આધીન છે. સતપંથનો એક મહત્વનો સિદ્ધાંત છે કે હિંદુઓના ચાર યુગ ને મૂળમાં રાખીને તેના પર એવો પ્રચાર કરવામાં આવ્યો છે (જે હિંદુ ધર્મ પ્રમાણે તદ્દન ખોટો છે) કે દરેક યુગમાં એક વેદ, એક મંત્ર, એક ભગવાન, એક પૂજા, એક નદી, એક દાગ (મડદાને આપતો દાહ) વગેરે વગેરે છે. આ સિદ્ધાંત પ્રમાણે અગાઉ ત્રણ યુગમાં જે પ્રચલિત હતા, તે હવેના છેલ્લા એટલે કે કલિયુગમાં તેને કોઈ સ્થાન નથી. તેને માત્ર નમસ્કાર કરવા જોઈએ અને પૂજન તથા પાલન માત્ર ઉપર જણાવેલ પેમ્પલેટમાં કલિયુગના કોલમ પ્રમાણે જ કરવું જોઈએ.

હવે કારણ કે પીરાણા સતપંથના આ પેમ્પલેટ પ્રમાણે સતપંથીઓ માત્ર, તેમના પ્રમાણે (હિંદુ ધર્મ પ્રમાણે નહિ) કલિયુગમાં પ્રવર્તમાન વેદ એટલે કે અથર્વવેદને જ માને છે અને અન્ય ત્રણ વેદને નથી માનતા, **એટલે આ લેખમાં આપણે આપણું ધ્યાન અથર્વવેદ અને ઈમામશાહ ઉપર વધારે કેન્દ્રિત કરશું. તેમ છતાં અન્ય ત્રણ વેદ ઉપર ઉડતી નજર જરૂર કરશું.**

## ૨. શરૂવાત કરીએ દશાવતારની પત્રિકામાં છાપેલ વેદો અને તેની સાથે જોડેલ નામો થી

**તો પહેલા ઈતિહાસ જાણીએ કે વેદો ક્યાંથી આવ્યા?** હિંદુ ધાર્મિક શાસ્ત્રો, ઈતિહાસકારો, સરકારી દસ્તાવેજો, સંશોધનકરો અને લગભગ સર્વે જ્ઞાની લોકોનું એક મત છે કે વેદોના કોઈ લેખક નથી. એ દૈવી પુસ્તક છે. હિંદુ શાસ્ત્રોમાં આના માટે જે શબ્દ વપરાય છે તે છે "अपौरुषेय", ગુજરાતીમાં "અપૌરૂશેય", એટલે કે કોઈ પણ વ્યક્તિ કે માણસ ની ક્ષમતાથી બહાર છે. એટલે કે ભગવાન દ્વારા કરવામાં આવેલ છે.

બીજી વાત અહીં ધ્યાનમાં રાખવા જેવી એ છે કે અનંત કાળથી વેદો ચાલતા આવ્યા છે. એમાં અક્ષરરોની રચના એવી છે કે તેની પાછળ ગણિત પણ છે. માટે જો કોઈ વચ્ચે એક અક્ષર પણ બદલાય તો ગણિત તૂટી જાય અને ખબર પડી જાય કે અહીં ગડબડ છે. માટે વેદોના મંત્રો આજે પણ સચોટ મળતા રહ્યા છે. તેમ છતાં ઈતિહાસકારો ને જે વેદોની લેખિત પ્રતો મળ્યા છે, તેને પણ લગભગ ૪ થી ૫ હજાર વર્ષ થઇ ચુક્યા છે.

realpatidar.com

realpatidar.com

ટૂંકમાં કહીએ તો વેદો હજારો વર્ષોથી યથાવત ચાલતા આવ્યા છે અને તેના કોઈ માનવ રચઈતા નથી

**૩. હવે આપણે સમજીએ કે આમંત્રણ પત્રીમાંમાં છપાયેલ વેદોના નામો સાથે ઋષીઓ અને મુસલમાન ઈમામશાહનું નામ જોડવા પાછળના સંભવિત કારણો શું હોઈ શકે?**

હાલમાં ઉભો થયેલ વિવાદ અને તેના કારણે મચેલ ખળભળાટ પાછળનું કારણ છે કે વિદો સાથે એક મુસલમાન ધર્મ પ્રચારકનું નામ જોડવું. સામાન્ય નિયમ એમ હોય છે કે કોઈ ગ્રંથ સાથે તેના રચેઈતાનું નામ લખવામાં આવે છે. માટે અહીં અથર્વવેદ સાથે ઈમામશાહનું નામ જોડવાથી સ્વાભાવિક છે કે લોકો સમજશે કે અથર્વવેદના રચેઈતા ઈમામ શાહ છે, તેવો આ પત્રિકા દ્વારા સંદેશો આપવામાં આવે છે. જે સત્યથી જુદો છે. માટે જ આ રોષ જાગેલ છે. જો અથર્વવેદ સાથે મુસલમાન ઈમામશાહનું નામ જોડવા પાછળ કોઈ અન્ય કારણ હોય, તો તે છાપવું જોઈએ. આ અંગે બેદરકાર રહેવું એ માફીને પાત્ર નથી.

**૪. તો પ્રશ્ન ઉભો થશે કે પીરાણા સતપંથના અનુયાયીયો જુઠ્ઠી વાત શા માટે છાપીને પ્રસિદ્ધ કરતા હશે?**

આ પ્રશ્નનો જવાબ જાણવા માટે આપણે પહેલા સતપંથની સ્થાપના તેમજ ઈમામશાહનો ઈતિહાસ જાણવો પડશે. સાથે સાથે સતપંથના ધાર્મિક પુસ્તકો પણ જાણવા પડશે.

સતપંથના મૂળ સ્થાપક પીર સદ્દ્દીન (એટલે કે ઈમામશાહ ના દાદા) જયારે ઇસ્લામના પ્રચાર માટે ભારત આવ્યા, ત્યારે તેમને સફળતા નોહતી મળતી. માટે તેઓએ હિંદુ ધર્મ શાસ્ત્રોનો ઊંડાણ પૂર્વક અભ્યાસ કર્યો અને હિંદુ ધર્મ શાસ્ત્રોને ભ્રષ્ટ કર્યા.

realpatidar.com

realpatidar.com

ભ્રષ્ટ કરેલ શાસ્ત્રોમાં મુખ્ય બે શાસ્ત્રો છે...

૧) દશાવતાર (જેની કથા દુર્ગાપુરમાં સતપંથીઓ દ્વારા યોજવામાં આવેલ છે.)

૨) અથર્વ વેદ

આ શાસ્ત્રોમાં પીર સદ્દદીને બાહ્ય રૂપ હિંદુનું રાખ્યું. જેમ કે હિંદુ દેવો રામ, કૃષ્ણ વગેરેને માન્ય. પણ ચતુરાઈ વાપરીને એ જ હિંદુ દેવોના મુખે ઇસ્લામનો છૂપો સંદેશો આપ્યો છે, તેવું બતાવામાં આવ્યું. માટે દાખલા રૂપે સતપંથ દશાવતારમાં મડદાને ભૂમિદાગ આપવાનું કહ્યું છે તેવું લોકોને જણાવ્યું. પોતાની વાતને વજનદાર બનવા માટે જણાવ્યું કે નીલા જાડનું પાંદડું તોડું પાપ છે, માટે મડદાને બળવું ન જોઈએ માત્ર દાટવું જોઈએ.

હાલમાં મડદાને દાટવાની વાતને વેદોક્ત બતાવ માટે અથર્વવેદના શ્લોકોનો હેમખેમ અર્થઘટન કરીને એવું જુઠી રીતે બતાવામાં આવ્યું કે અથર્વવેદમાં જણાવ્યું છે કે મડદાને દાટવું જોઈએ. (આ બનાવટની સંપૂર્ણ વિગત જુવો http://www.realpatidar.com/a/series61)

ટૂંકમાં હિંદુઓને આકર્ષિત કરી તેમના દ્વારા ઇસ્લામી રીત રીવાજ પાળવા માટે તેમના મનને હળવાશથી મનાવા માટે હિંદુ ધાર્મિક પુસ્તકોના નામો ધરાવતા બનાવટી સતપંથના શાસ્ત્રો રચવામાં આવ્યા. આ શાસ્ત્રોના જોરે ઈમામશાહે કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિના લોકોને શિકાર બનાવ્યા અને તેમને ભારતીય નામ ધરવતા (એટલે કે સતપંથ નામ ધરવતા) ઈસ્માલ ધર્મ ને પાળતા કરી દીધા.

માટે સતપંથ અથર્વવેદની રચના હિંદુઓનું ધર્મ પરિવર્તન કરી ને મુસલમાન કરવા માટે જ કરવામાં આવેલ છે તે સમજી શકાય તેવી વાત છે.

<u>૫. ઈતિહાસકારો, સરકારી દસ્તાવેજો, સંશોધનકરો વગેરે બૌધિકોનું શું માનવું છે તે જોઈએ:</u>

સમસ્ત માનવ જાતનું સહુંથી જુનું લેખિત કામ આજે પણ અકબંધ હોય તો તે છે ઋગ્વેદ. બાકીના ત્રણ વેદ તેના પછી છે. ઈતિહાસકારો જણાવે છે કે વેદોની પ્રથમ લેખિત પ્રત્તો મળ્યા તેને પણ હજારો realpatidar.com

realpatidar.com

વર્ષ થઇ ગયા છે. તેનાથી પહેલા વેદોનો અસ્તિત્વ હતો. તે જમાનામાં જાડના પાંદડામાં લખવામાં આવતું જે લાંબા સમય સુધી ટકી ન રહી શકે માટે એક સમય મર્યાદા થી જુના પ્રતો મળી શકે તેમ નથી. પણ અગાઉ જણાવ્યા પ્રમાણે વેદોમાં અક્ષરોની પાછળ ગણિત હોવાના કારણે વેદો સચોટ રીતે આજે પણ આપણી પાસે છે.

બીજી બાજુ ઈમામશાહ ને લગભગ ૫૦૦ વર્ષ માત્ર થયા છે. તેમના સમય કાળથી હજારો વર્ષ પહેલા વેદો અસ્તિત્વમાં હતા. આ પણ હકીકત બતાવે છે કે ઈમામ શાહ વેદના રચેઈતા નોહતા. આ હકીકત ઈતિહાસ પ્રમાણે સાબિત થયેલ છે.

## <u>૬. પીરાણા સતપંથના અનુયાયિયોએ પોતાના બચાવ માટે શું વિચારી રાખ્યું હશે?</u>

પચાણ કાકા અને સહયોગી દ્વારા વર્ષ ૧૯૯૮માં ફાઈલ થયેલ એક કોર્ટ કેસમાં કરસન કાકા સામે આરોપ લાગ્યો હતો કે પીરાણામાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને વિષ્ણુના અવતારો જેવા કે રામ, કૃષ્ણ વગેરેના ચિત્રો દોરીને કરસન કાકા પીરાણા સતપંથને હિંદુ ધર્મ બતાવાની કોશિશ કરી રહ્યા છે. આ આરોપ સામે કરસન કાકા એ કોર્ટમાં જવાબ આપ્યો કે જે ચિત્રો દોરવામાં આવ્યા છે તે માત્ર સજાવટ માટે છે. તે ચિત્રોની પૂજા કરવા માટે નથી.

ફસાય ત્યારે આવો તર્ક કદાચ અહીં પણ સતપંથીઓ દ્વારા વાપરવામાં આવે. તેઓ કહી શકે છે કે ઈમામ શાહનું નામ અથર્વવેદ ના રચેઈતા તરીકે નથી પણ કોઈ અન્ય કારણ હોઈ શકે. જેમ કે ઈમામ શાહ એ અથર્વવેદના પ્રચારક છે / સદગુરુ છે વગેરે વગેરે.

પણ પ્રચારક તરીકે પણ અગર ઈમામ શાહનું નામ જોડે તો પણ એ એક ભયંકર ભૂલ હશે. કારણ કે ઈતિહાસ બતાવે છે કે અથર્વવેદની આડ લઇને ઈમામશાહ એ ઇસ્લામ ધર્મનો પ્રચાર કર્યો છે. માટે ગમે તે કારણ બતાવે મૂળમાં ઈમામ શાહનું નામ હિંદુઓનું ધર્મ પરિવર્તન કરાવનાર તરીકે છે, તેમાં કોઈ બે મત નથી.

realpatidar.com

realpatidar.com

**૭. સારાંશ:** ઈમામ શાહે ભ્રષ્ટ કરેલ દશાવતાર અને અથર્વવેદ જેવા ગ્રંથોના આધારે હિંદુઓને આકર્ષિત કરીને તેમનું ધર્મ પરિવર્તન કરી તેમને મુસલમાન બનાવેલ છે. પીરાણા સતપંથના અનુયાયી પણ એજ દશાવતાર અને અથર્વવેદ નો પ્રચાર કરીને ઈમામશાહનું ધર્મ પરિવર્તન કરાવવાનું કામ આગળ વધારી રહ્યા છે.

Real Patidar

www.realpatidar.com

realpatidar.com



॥ શ્રી ઉમિયા માતાય નમઃ ॥

॥ નિમંત્રણ ॥

પરમ આદરણીય સ્નેહી શ્રી

પરમ કૃપાળુ શ્રી નિષ્કલંકી નારાયણ મહાપ્રભુજી અને સદ્‌ગુરૂ શ્રી ઈમામશાહ મહારાજ એવમ્ પરમકૃપાળુ કુળદેવી શ્રી ઉમિયા માતાજીની અસીમ કૃપા તેમજ બ્રહ્મલિન પ.પૂ. વીરવર્ય આદ્ય જગદ્‌ગુરૂ સતપંથાચાર્ય શ્રી કરશનદાસજી મહારાજની પ્રેરણા અને પ.પૂ. જગદ્‌ગુરૂ સતપંથાચાર્ય શ્રી નાનકદાસજી મહારાજ તેમજ સંતો મહંતો અને વડીલોના શુભાશિષથી સમસ્ત માનવ જગતના કલ્યાણ અને વિશ્વ શાંતિ માટે શ્રીમદ્ ભાગવત દશાવતાર જ્ઞાનયજ્ઞ પારાયણનું મંગલ આયોજન કરેલ છે.

શ્રીમદ્ ભાગવત દશાવતાર શ્રી પરમાત્માના સાક્ષાત્ સ્વરૂપ છે જે કથાના શ્રવણમાત્રથી આદિ દૈવિક આદિ ભૌતિક અને આધ્યાત્મિક તપનું શમન થાય છે. જેનું સેવન કરવાથી મનુષ્યનાં પુણ્યનો દિવ્ય ઉદય થાય છે.

પરમ પૂજ્ય મહંતશ્રી સતપંથરત્ન મહામંડલેશ્વર શ્રી જનાર્દનહરિજી મહારાજ ફૈજપુર (મહારાષ્ટ્ર) વ્યાસપીઠ પર બિરાજી સંગીતમય શૈલી સાથે કથાનું રસપાન કરાવશે. સમસ્ત વાતાવરણ ભક્તિના રંગે રંગાશે. ભાવિ પેઢીમાં શ્રદ્ધા અને ભક્તિ વધશે તથા સંસ્કારનું સિંચન થશે. પ્રભુ પ્રત્યેનો ભાવ નવ પલ્લવિત થશે. પરસ્પર ભાઈચારાનો સંબંધ ગાઢ થશે. આ મહાયજ્ઞ ભક્તિગંગામાં પાવન થવા સહપરિવાર તથા મિત્ર મંડળ સહિત પધારવા સ્નેહભર્યું આમંત્રણ છે.

:: આયોજક ::

શ્રી દુર્ગાપુર ધોળુ પરિવાર

શ્રી દુર્ગાપુર સતપંથ સનાતન સમાજ

નોંધ : સમગ્ર જ્ઞાનયજ્ઞ કથા દરમ્યાન સવારે ચા-નાસ્તો, બપોરે ભોજન-પ્રસાદ અને સાંજે બ્રહ્મભોજનની વ્યવસ્થા રાખેલ છે. સૌ ભક્તજનોને ભોજન પ્રસાદનો લાભ લેવા વિનંતી છે.

# કથાના પુનિત પ્રસંગો

તા. ૧૮-૫-૨૦૧૬, બુધવાર

સવારે
૮.૦૦ કલાકે
સંતોના સામૈયા
પોથીયાત્રા,
પોથી પૂજન
કથા પ્રારંભ

બપોરે
મત્સ્ય અવતાર
ભકત રૂખ્માનંદ ચરિત્ર

..., ગુરૂવાર

સવારે
શ્રી કુર્મ અવતાર
ભકત અમરિષ ચરિત્ર
શ્રી વરાહ અવતાર
ભકત ધ્રુવ ચરિત્ર

બપોરે
શ્રી નરસિંહ અવતાર, ભકત પ્રહલાદ ચરિત્ર
શ્રી વામન અવતાર, ભકત કમલાધન ચરિત્ર
(પ્રત્યક્ષ દર્શન)
શ્રી પરશુરામ અવતાર,
ભકત કમલાપતિ ચરિત્ર

ભજન સંધ્યા સાંજે ૮:૦૦ કલાકે

॥ શ્રી મત્સ્ય અવતાર ॥

भुतलातल मध्यस्यं, शंखासुरं निहत्य च ।
उद्वेताः येन वे, वेदाः तस्मै मत्स्यात्मने नमः ।।

જે પરમાત્માએ ભૂતળ અને અતળની વચમાં રહીને શંખાસુર નામના દૈત્યનો નાશ કરીને વેદોનો ઉધ્ધાર કર્યો હતો, તે શ્રી મત્સ્ય રૂપને હું નમસ્કાર કરૂં છું.

॥ શ્રી કુર્મ અવતાર ॥

ससागरवनांनि विभ्रत सप्तद्विपां वसुंधराम।
यो धारयति पृष्ठेन, तस्मै कूर्मात्मिने नमः ।।

જે પોતાની પીઠ ઉપર સમુદ્રો અને વનો સહિત સાત દ્રીપવાળી પૃથ્વીને ધારણ કરે છે. તે શ્રી કુર્મ રૂપ અવતારને હું નમસ્કાર કરૂં છું.

॥ શ્રી વરાહ અવતાર ॥

महार्णवे निमग्नां वाराहं रुप्मास्थितः।
य उज्जहार दंष्ट्राभ्यां तस्मै कोड़त्मने नमः ।।

જેમણે વરાહ રૂપ લઈને એકાકાર થયેલા મહાસાગરમાં ડુબી ગયેલી પૃથ્વીને બહાર કાઢી હતી તે શ્રી વરાહ રૂપ અવતારને હું નમસ્કાર કરૂં છું.

॥ શ્રી નરસિંહ અવતાર ॥

नारिसंहवपुः कृत्वा, यस्त्रैलोक्य भयंडकरम।
हिरण्यकशिपु जघ्ने तस्मै सिंहात्मने नमः ।।

જેમણે ત્રણે લોકને ભય આપનારૂ એવું નરસિંહરૂપ ધારણ કરીને હિરણ્યકશ્યપનો નાશ કર્યો હતો, તે શ્રી નરસિંહ અવતારને હું નમસ્કાર કરૂં છું.

॥ શ્રી વામન અવતાર ॥

वामनं रुपमास्याय, बलिं संयम्य मायया ।
येन क्रान्ताः त्रयो लोकाः तस्मै क्रान्तात्मने नमः ।।

જેમણે વામન રૂપ ધારણ કરી માયા વડે બલી રાજાને વશ કરીને ત્રણે લોકને ત્રણ પગલાંથી ભરી લીધા હતા તે શ્રી વામન અવતારને હું નમસ્કાર કરૂં છું.

॥ શ્રી પરશુરામ અવતાર ॥

जमदग्नि सुतो भूत्वा रामः परशुधृग्विभुः।
सहस्त्रार्जुनहन्ता यः तस्मै उग्रात्मने नमः ।।

જે પરમાત્માએ જમદગ્નિ ઋષિના પુત્ર પરશુરામ રૂપે હાથમાં ફરશી ધારણ કરીને સહસ્ત્રાર્જુન દૈત્યનો નાશ કર્યો હતો, તે ઉગ્ર મૂર્તિરૂપ શ્રી પરશુરામ અવતારને હું નમસ્કાર કરૂં છું.

realpatidar.com
પુનિત પ્રસંગો
શ્રી
તા. ૨૦-૫-૨૦૧૬,
સવારે
શ્રી રામજન્મોત્સવ,
ભકત હરિશ્ચંદ્ર
(પ્રત્યક્ષ દર્શન)
બપોરે
શ્રી સીતા સ્વયંવર
(પ્રત્યક્ષ દર્શન)
તા. ૨૧-૫-૨૦૧૬, શનિવાર
સવારે
શ્રી રામાયણ
ભકત શબરી ચરિત્ર
કેવટ પ્રસંગે
બપોરે
શ્રી કૃષ્ણ જન્મોત્સવ,
(પ્રત્યક્ષ દર્શન)
લોક ડાયરો : સાંજે ૮:૦૦ કલાકે
તા. ૨૨-૫-૨૦૧૬, રવિવાર
સવારે
શ્રી કૃષ્ણ લીલા
(પ્રત્યક્ષ દર્શન)
બપોરે
શ્રી રૂક્ષ્મણી વિવાહ
(પ્રત્યક્ષ બે લગ્ન)
॥ શ્રી રામ અવતાર ॥
रामो दाशरथिर्भुत्वा पौलस्त्य कुल लांछनम ।
जधान रावणं संख्ये तस्मै क्षत्रात्मने नमः ।।
જેમણે દશરથના પુત્ર રામચંદ્ર રૂપે થઈને પુલસ્ત્ય કુળમાં જન્મેલા
રાવણનો યુધ્ધમાં આખા કુળ સહિત નાશ કર્યો હતો તે ક્ષત્રિય
રૂપ શ્રી રામ અવતારને હું નમસ્કાર કરૂં છું.
॥ શ્રી કૃષ્ણ અવતાર ॥
वसुदेवसुतः श्रीमानवासुदेवो जगत्पतिः ।
जहार वसुधामारं तस्मै कृष्णात्मने नमः ।।
જગતપતિ એવા શ્રીમાન વાસુદેવે, વાસુદેવના પુત્ર થઈ
પૃથ્વીનો ભાર ઉતાર્યા, તે શ્રી પરમાત્માના શ્રીકૃષ્ણ અવતારને
હું નમસ્કાર કરૂં છું.
સાંસ્કૃતિક કાર્યક્રમ : સાંજે ૮:૦૦ કલાકે

realpatidar.com
કથાના પુનિત
તા. ૨૩-૫-૨૦૧૬, સોમવાર
સવારે
સંપૂર્ણ મહાભારત
બુધ્ધ અવતાર
બપોરે
પાંડવોનું સ્વર્ગારોહણ
૨૦૧૬, મંગળવાર
બપોરે
શ્રી નિષ્કલંકી નારાયણ
અવતાર (પ્રત્યક્ષ દર્શન)
કથા વિરામ
॥ શ્રી બુધ્ધ અવતાર ॥
बुद्धरुपं समासाध सर्वरुपं परायण: ।
मोह्यन् सर्वभूतानि तस्मै मोहात्मने नम: ।।
સર્વરૂપ પરાયણ એવા જે પરમાત્માએ
બુધ્ધનું રૂપ ધારણ કરીને સર્વ પ્રાણીઓને મોહિત
કર્યા હતા તે ભગવાન શ્રી બુધ્ધ અવતારને હું નમસ્કાર કરૂં છું.
॥ શ્રી નિષ્કલંકી અવતાર ॥
हनिष्यति कलौ मध्ये म्लेच्छांन्तुर्गवाहन: ।
धर्म संस्थापनार्थाय तस्मै कल्क्यात्मने नम: ।।
ધર્મની થયેલી ગ્લાનિ પછી, ધર્મને પાછો સ્થાપન કરવા માટે કલીયુગને અંતે
શ્વેત ઘોડા ઉપર ચડીને કાલિંગા દૈત્ય અને અધર્મીઓનો નાશ કરશે
તે શ્રી નિષ્કલંકી રૂપ અવતારને હું નમસ્કાર કરૂં છું.
તા. ૨૩-૫-૨૦૧૬, સોમવાર
નિયાણીઓને દાનભેટ
બપોરે ૫:૦૦ કલાકે
રાસ-ગરબા : સાંજે ૮:૦૦ કલાકે

realpatidar.com
यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारतः ।
अभ्युत्थानम् धर्मस्य तदाऽऽत्मानं सृजाम्यहम् ।।
હે, ભારત ! જ્યારે જ્યારે ધર્મની હાનિ
અને અધર્મની વૃધ્ધિ થાય છે,
ત્યારે હું જન્મ ધારણ કરું છું.
ૐ નમો શ્રી નિષ્કલંકી નારાયણ જનાર્દનાય । ભસ્માયુધાય વિદ્મહે
દિવ્યનેત્રાય ધી મહિ । તન્નોજવરહરઃ પ્રચોદયાત્ । તન્નોજવરહરઃ પ્રચોદયાત્ ।
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ॥
ૐ કારં બિન્દુ સંયુકતં નિત્ય ધ્યાયન્તી યોગીનઃ
કામદં મોક્ષદં ચૈવ ૐ કરાય નમો નમઃ
અમરતેજ
ઋગ્વેદ
વશિષ્ટ ઋષિ
યજુર્વેદ
વેદ વ્યાસ
સામવેદ
ઈમામશાહ મહારાજ
અથર્વવેદ
realpatidar.com

આશીર્વચન
૨૫-૫-૨૦૧૬, બુધવાર
મહામંડલેશ્વર
સ્વામીશ્રી અલખગિરીજી મહારાજ,
શ્રી ગાયત્રી શકિતપીઠ, ભરૂચ
મહામંડલેશ્વર
સ્વામીશ્રી દિલીપદાસજી મહારાજ,
જગન્નાથ મંદિર, અમદાવાદ.
મહામંડલેશ્વર
સ્વામીશ્રી ધર્મદેવજી મહારાજ,
પટૌડી, હરિયાણા
પ.પૂ. શ્રી રવિદાસ મહારાજ
પ્રેરણાપીઠ, પીરાણા
પ.પૂ. મહંતશ્રી
જયરામદાસજી મહારાજ
શ્રી નિષ્કલંકીધામ-નખત્રાણા
પ.પૂ. મહંતશ્રી
શિવગણદાસજી મહારાજ
અથર્વવેદિક સતપંથ સેવા
આશ્રમ-કાઠીયા મોટા
સ.ગુ. શાસ્ત્રી ભક્તિપ્રકાશદાસજી
મહારાજ
શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ,
સાવદા (મહારાષ્ટ્ર)
રાષ્ટ્રીય કિર્તનકાર
હ.ભ.પ.
શ્રી યોગેશ્વરી ઉપાસનીજી મહારાજ
અમલનેર (મહારાષ્ટ્ર)
રામા મંડળ : સાંજે ૮:૦૦ કલાકે

realpatidar.com
કથાના પુનિત પ્રસંગો
પ્રેરણા મૂર્તિ
ગોત્ર : પિપલાદ ઋષિ

# દિવ્ય સંત સાનિધ્ય

**પ. પૂ. જગદ્ગુરૂ સતપંથાચાર્ય શ્રી નાનકદાસજી મહારાજ**
પ્રેરણાપીઠ - પીરાણા, ગુજરાત
સંરક્ષક, અખિલ ભારતીય સંત સમિતિ, ભારત

**પ.પૂ. શ્રીમદ્ અનંત વિભુષિત જગદ્ગુરૂ રામાનંદાચાર્ય સ્વામી હંસદેવાચાર્યજી મહારાજ**
સ્વામી જગન્નાથધામ ટ્રસ્ટ, હરિદ્વાર
રાષ્ટ્રીય નિર્દેશક, શ્રી અખિલ ભારતીય સંત સમિતિ, ભારત

**મહામંડલેશ્વર સ્વામીશ્રી અલખગિરીજી મહારાજ**
શ્રી ગાયત્રી શકિતપીઠ, ભરૂચ

**મહામંડલેશ્વર સ્વામીશ્રી દિલીપદાસજી મહારાજ,**
જગન્નાથ મંદિર, અમદાવાદ.

**મહામંડલેશ્વર સ્વામીશ્રી ધર્મદેવજી મહારાજ**
પટૌડી, હરિયાણા

**શ્રી મહંત રાજેન્દ્રદાસજી મહારાજ**
નિર્મોહી અખાડા

**પ.પૂ. સંતશ્રી શાન્તીદાસ મહારાજ**
રવિભાણ આશ્રમ, મોટી વિરાણી, નખત્રાણા

**સ. ગુ. શાસ્ત્રી ભક્તિપ્રકાશદાસજી મહારાજ**
શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ, સાવરા (મહારાષ્ટ્ર)

**શ્રી મહેન્દ્ર ઝા**
ટ્રસ્ટી શ્રી જગન્નાથ મંદિર, અમદાવાદ

**પ.પૂ. મહંતશ્રી રવિદાસજી મહારાજ**
પ્રેરણાપીઠ, પીરાણા, ગુજરાત

**પ.પૂ. મહંતશ્રી શામળદાસજી મહારાજ**
પ્રેરણાપીઠ, પીરાણા, ગુજરાત

**પ.પૂ. મહંતશ્રી પુરુષોત્તમદાસજી મહારાજ**
ગુરૂકુળ, પ્રેરણાપીઠ, પીરાણા - ગુજરાત

**પ.પૂ. મહંતશ્રી જયરામદાસજી મહા...**
શ્રી નિષ્કલંકીધામ, નખત્રાણા - કચ્છ

**પ.પૂ. મહંતશ્રી શિવગણદાસજી મ...**
અથર્વવૈદિક સતપંથ સેવા આશ્રમ, ... કચ્છ

**પ.પૂ. મહંતશ્રી શિવરામદાસજી મ...**
શ્રી નાયાકાકા મહારાજ સંસ્થાન, કુકમ ...

**પ.પૂ. સંતશ્રી તુલસીબાપા**
સંતશ્રી નથુરામબાપા આશ્રમ, વડાલી કંપા - સાબરકાંઠા

**રાષ્ટ્રીય કિર્તનકાર હ.ભ.પ. શ્રી યોગેશ્વર ઉપાસનીજી મહારાજ**
અમલનેર (મહારાષ્ટ્ર)

**પ.પૂ. યોગતપોનિષ્ઠ શ્રી પ્રેમદાસ બાપુ**
પંચવટી દહેગામ-ગુજરાત (અમેરીકા)

**પ.પૂ. સંતશ્રી શાંતિદાસ ભગત**
અખડ આનંદ કુટિર, ગોતા કંપા - ખેડબ્રહ્મા

**પ.પૂ. સંતશ્રી જયભગવાનબાપા**
લક્ષ્મણપુરા કંપા - વડાલી

**પ.પૂ. ગોસ્વામી મહંતશ્રી ધનગીરી બાપુ**
દેવરાજધામ ગુરૂગાદી, સંતશ્રી દેવાયત પંડિત
ચેતન સમાધી મંદિર, બાજકોટ, મોડાસા, જી. અરવલ્લી

realpatidar.com
પ્રેરણામૂર્તિ
શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સનાતન સતપંથ સમાજ,
પ્રેરણાપીઠ - પીરાણા
સતપંથ સનાતન સેવા મંડળ - કચ્છ
શ્રી નિષ્કલંકી ધામ, નખત્રાણા - કચ્છ
પ્રેરિત
શ્રી દુર્ગાપુર સતપંથ સનાતન સમાજ
શ્રી દુર્ગાપુર મહિલા મંડળ સતપંથ સનાતન સમાજ
પત્ર વ્યવહાર
શ્રી દુર્ગાપુર ધોળુ પરિવાર
શ્રી દુર્ગાપુર સતપંથ સનાતન સમાજ
રૂપારેલવાળી, દુર્ગાપુર, તા. માંડવી, જી. કચ્છ
સંપર્ક
અબજીભાઈ ધોળુ
મો. ૯૮૨૫૦ ૩૮૪૬૧
શાંતિભાઈ ધોળુ
મો. ૯૮૨૫૦ ૪૮૦૮૨
પ્રભુલાલ ધોળુ
મો. ૯૮૨૫૨ ૨૭૦૯૪
છગનલાલ ધોળુ
મો. ૯૮૨૫૨ ૨૫૦૯૪
હીરાભાઈ ધોળુ
મો. ૯૮૨૫૨ ૨૫૪૭૩
નવિનચંદ્ર ધોળુ
મો. ૯૮૨૫૦ ૪૮૦૭૨
જગદીશભાઈ ધોળુ
મો. ૯૮૨૫૦ ૭૮૮૨૫
પ્રવિણભાઈ વેલાણી
મો. ૯૮૨૫૩ ૮૫૬૦૧
વિનેશભાઈ ધોળુ
મો. ૯૮૨૫૨ ૩૫૮૨૫
॥ ચલો સત્ કે પંથ પર ॥
લાઈવ પ્રસારણ : દીશા ચેનલ ઉપર

realpatidar.com
યજમાન પરિવાર
શ્રી લધાભાઈ નાનજીભાઈ ધોળુ
સ્વ. વાલબાઈ લધાભાઈ ધોળુ
શ્રીમતી જવેરબેન સામજીભાઈ ધોળુ
શ્રીમતી મણીબેન ડાયાભાઈ ધોળુ
શ્રીમતી કમળાબેન અરજણભાઈ ધોળુ
શ્રીમતી મણીબેન નારણભાઈ ધોળુ
શ્રીમતી અરૂણાબેન મોહનભાઈ ધોળુ
શ્રીમતી ઊર્મિલાબેન શાંતીભાઈ ધોળુ
શ્રીમતી હેમલતાબેન નવિનચંદ્ર ધોળુ
શ્રીમતી આશાબેન રમેશભાઈ ધોળુ
શ્રીમતી કાજલબેન ભરતભાઈ ધોળુ
શ્રીમતી ચંદ્રિકાબેન સુનીલભાઈ ધોળુ
શ્રીમતી પ્રવિણાબેન બીપીનભાઈ ધોળુ
શ્રીમતી હેમિક્ષાબેન રૂપેશભાઈ ધોળુ
શ્રીમતી ડિમ્પલબેન હિરેનભાઈ ધોળુ
શ્રીમતી ઉન્નતીબેન હિતેશભાઈ ધોળુ
સુરેશકુમાર ડાયાલાલ ધોળુ
હેતકુમાર નવિનચંદ્ર ધોળુ
જીમીતકુમાર નવિનચંદ્ર ધોળુ
વિષ્ણુકુમાર મોહનલાલ ધોળુ
ધૈર્યકુમાર રમેશભાઈ ધોળુ
માનકુમાર ભરતભાઈ ધોળુ
ધ્રુવકુમાર બીપીનભાઈ ધોળુ
જેનિલકુમાર રૂપેશભાઈ ધોળુ
જૈન્યકુમાર સુનીલભાઈ ધોળુ
કવિતા શાંતીભાઈ ધોળુ
સુચી શાંતીભાઈ ધોળુ
એંજલ સુનીલભાઈ ધોળુ
પરી ભરતભાઈ ધોળુ
ધ્રુવી બીપીનભાઈ ધોળુ
શ્રી કરમશીભાઈ લખુભાઈ ધોળુ
શ્રીમતી રામબાઈ કરમશીભાઈ ધોળુ
શ્રીમતી લીલાબેન શીવજીભાઈ ધોળુ
શ્રીમતી શાન્તાબેન અભજીભાઈ ધોળુ
શ્રીમતી કસ્તુરબેન મોહનલાલ ધોળુ
શ્રીમતી ગીતાબેન હિરાલાલ ધોળુ
શ્રીમતી પારૂલબેન જગદીશભાઈ ધોળુ
શ્રીમતી જાગૃતિબેન વીનેશભાઈ ધોળુ
શ્રીમતી આકૃતિબેન અશ્વિનભાઈ ધોળુ
શ્રીમતી પીનલબેન રાહુલભાઈ ધોળુ
શ્રીમતી રીટાબેન કલ્પેશભાઈ ધોળુ
શ્રીમતી અલ્પાબેન ઉપેશભાઈ ધોળુ
ઓમકુમાર હિરાલાલ ધોળુ
મનનકુમાર વિનેશભાઈ ધોળુ
ક્રિશકુમાર જગદીશભાઈ ધોળુ
જીનયકુમાર વિનેશભાઈ ધોળુ
રૂદ્રકુમાર રાહુલભાઈ ધોળુ
વિશ્વકુમાર અશ્વિનભાઈ ધોળુ
વિવાનકુમાર રાહુલભાઈ ધોળુ
વેદકુમાર કલ્પેશભાઈ ધોળુ
નક્ષકુમાર ઉપેશભાઈ ધોળુ
દ્રષ્ટિ હિરાલાલ ધોળુ
નિધી હિરાલાલ ધોળુ
પ્રાચી જગદીશભાઈ ધોળુ
પંક્તિ જગદીશભાઈ ધોળુ
અંશી જગદીશભાઈ ધોળુ
ધાર્મી કલ્પેશભાઈ ધોળુ
વેદા અશ્વિનભાઈ ધોળુ
નૈયા ઉપેશભાઈ ધોળુ
શ્રી મુળજીભાઈ કાનજી
શ્રીમતી મોંઘીબેન મુળજી
શ્રીમતી કસ્તુરબેન મનજીભાઈ
શ્રીમતી કસ્તુરબેન પ્રભુલાલ ધોળુ
શ્રીમતી હંસાબેન છગનલાલ ધોળુ
શ્રીમતી નિલમબેન ભાવેશભાઈ ધોળુ
શ્રીમતી પ્રિયાબેન રવિશભાઈ ધોળુ
શ્રીમતી દ્રષ્ટિબેન નિકુલભાઈ ધોળુ
માનવકુમાર છગનલાલ ધોળુ
વિવાનકુમાર ભાવેશભાઈ ધોળુ
જીનલ છગનલાલ ધોળુ
પિનલ છગનલાલ ધોળુ
દર્શી રવિશભાઈ ધોળુ
નિયાણી
વેલબાઈ કલ્યાણજીભાઈ પોકાર
રાધાબેન ડાહ્યાલાલ પોકાર
વનીતાબેન કાન્તિલાલ ભગત
રતનબેન છગનલાલ પારસીયા
રંજનબેન દિલીપભાઈ રૂડાણી
હેતલબેન તપસ્વીકુમાર વાસાણી
શિવગણભાઈ નાનજીભાઈ ધોળુ
સવિતાબેન શિવગણભાઈ ધોળુ
શ્રીમતી પ્રભાબેન હીરાલાલ ધોળુ
શ્રીમતી વનીતાબેન ગોવિંદભાઈ ધોળુ
શ્રીમતી લીલાબેન નવીનભાઈ ધોળુ
શ્રીમતી ભાવનાબેન કિશોરભાઈ ધોળુ
શ્રીમતી હિનાબેન વિપુલભાઈ ધોળુ
શ્રીમતી કિંજલબેન સુધીરભાઈ ધોળુ
શ્રીમતી મૈત્રીબેન દિપેનભાઈ ધોળુ
શ્રીમતી જુલીબેન જીગરભાઈ ધોળુ
નિકુલકુમાર નવીનભાઈ ધોળુ
દર્શકકુમાર કિશોરભાઈ ધોળુ
પ્રીતકુમાર કિશોરભાઈ ધોળુ
જલકુમાર વિપુલભાઈ ધોળુ
હિયાંશકુમાર સુધીરભાઈ ધોળુ
દિવ્યા નવીનભાઈ ધોળુ
ખ્યાતિ નવીનભાઈ ધોળુ
નિશા નવીનભાઈ ધોળુ
વિશ્વા કિશોરભાઈ ધોળુ

realpatidar.com

## [illegible] શ્રી

| | |
|---|---|
| મુખીશ્રી [illegible] ભીમજીભાઈ [illegible] | શ્રી કરમશીભાઈ લખુભાઈ ધોળુ |
| મુખીશ્રી રતન[illegible] લાલજીભાઈ [illegible] | શ્રી મુળજીભાઈ કાનજીભાઈ ધોળુ |
| મુખીશ્રી હીર[illegible] લખુભાઈ [illegible] | શ્રી ધનજીભાઈ વિશ્રામભાઈ ધોળુ |
| શ્રી લધાભા[illegible] [illegible]નજીભાઈ ધોળુ | શ્રી ગોપાલભાઈ મુળજીભાઈ વાસાણી |
| શ્રી રતનશીભાઈ કાનજીભાઈ વાસાણી | શ્રી હંસરાજભાઈ કરમશીભાઈ ચૌધરી |
| શ્રી શીવજીભાઈ હરદાસભાઈ ચૌધરી | શ્રી લખમશીભાઈ વિશ્રામભાઈ ભોજાણી |
| શ્રી રતનશીભાઈ વાલજીભાઈ રૂડાણી | શ્રી શાંન્તીલાલ રવજીભાઈ ચૌધરી |
| શ્રી અરજણભાઈ લાલજીભાઈ વેલાણી | શ્રી હરીલાલ ધનજીભાઈ ચોપડા |

## આયોજન સમિતિ

| | | | |
|---|---|---|---|
| શિવજીભાઈ કરમશીભાઈ ધોળુ | હીરાલાલ શીવગણભાઈ ધોળુ | હીરાલાલ કરમશીભાઈ ધોળુ | ડાયાભાઈ લધાભાઈ ધોળુ |
| સામજીભાઈ લધાભાઈ ધોળુ | શાંતીલાલ સામજીભાઈ ધોળુ | કિશોરભાઈ શીવગણભાઈ ધોળુ | કિશોરભાઈ રતનશીભાઈ વાસાણી |
| રતનશીભાઈ લાલજીભાઈ વેલાણી | છગનલાલ મુળજીભાઈ ધોળુ | વિનેશભાઈ શીવજીભાઈ ધોળુ | દેવચંદભાઈ શીવજીભાઈ ચૌધરી |
| અબજીભાઈ કરમશીભાઈ ધોળુ | નવિનચંદ્ર સામજીભાઈ ધોળુ | નવીનભાઈ ધનજીભાઈ ધોળુ | સુનીલભાઈ છગનભાઈ ચૌધરી |
| પ્રભુલાલ મુળજીભાઈ ધોળુ | જગદીશભાઈ શીવજીભાઈ ધોળુ | લાલજીભાઈ રામજીભાઈ ધોળુ | અંબાલાલ રતનશીભાઈ વેલાણી |
| ધનજીભાઈ રામજીભાઈ ધોળુ | પ્રવીણભાઈ અરજણભાઈ વેલાણી | ગોવિંદભાઈ કરશનભાઈ ધોળુ | અશોકભાઈ ખીમજીભાઈ વાસાણી |

## સલાહકાર શ્રી

| | |
|---|---|
| મોહનલાલ કરમશીભાઈ ધોળુ | ધર્મેશભાઈ દિનેશભાઈ સેંઘાણી |
| અરજણભાઈ લધાભાઈ ધોળુ | પ્રદીપભાઈ મેઘજીભાઈ ધોળુ |
| મનજીભાઈ કાનજીભાઈ ધોળુ | જીતેન્દ્રભાઈ ઈશ્વરભાઈ વેલાણી |
| નારણભાઈ લધાભાઈ ધોળુ | ઉમેશભાઈ મેઘજીભાઈ વાસાણી |
| કુંવરજીભાઈ ધનજીભાઈ ધોળુ | બીપીનભાઈ નારણભાઈ ધોળુ |
| રતનશીભાઈ રામજીભાઈ ધોળુ | પ્રફુલભાઈ રતનશીભાઈ ધોળુ |
| અરજણભાઈ કરશનભાઈ ધોળુ | જયેશભાઈ નરસિંહભાઈ ચૌધરી |
| કલ્યાણજી રવજીભાઈ વાસાણી | હિતેશભાઈ શાંતીલાલ ધોળુ |
| શાંતીલાલ લાલજીભાઈ ધોળુ | હિરેનભાઈ હીરાલાલ ધોળુ |
| ભાણજીભાઈ વિશ્રામભાઈ ધોળુ | |

## યુવક મંડળ

| | |
|---|---|
| પ્રદિપભાઈ શીવદાસભાઈ સેંઘાણી | દિલીપભાઈ મનજીભાઈ ધોળુ |
| પરેશભાઈ ખીમજીભાઈ વાસાણી | વિનોદભાઈ મેઘજીભાઈ ધોળુ |
| સુરેશભાઈ શાંતીલાલ ચૌધરી | અશ્વિનભાઈ રામજીભાઈ રૂડાણી |
| ભરતભાઈ જેન્તીલાલ ધોળુ | નિતેશભાઈ શાંતીલાલ ચૌધરી |
| ભાવિનભાઈ વાલજીભાઈ ભોજાણી | રાહુલભાઈ અબજીભાઈ ધોળુ |
| હરેશભાઈ વાલજીભાઈ વેલાણી | અશ્વિનભાઈ મોહનલાલ ધોળુ |
| ભરતભાઈ અરજણભાઈ ધોળુ | ભાવેશભાઈ પ્રભુલાલ ધોળુ |
| કિશોરભાઈ અરજણભાઈ વેલાણી | જીગરભાઈ ગોવિંદભાઈ ધોળુ |
| | રમેશભાઈ ડાયાભાઈ ધોળુ |